

Navagrahastotra (with meanings)

——
नवग्रहस्तोत्र

——
Document Information



Text title : navagrahastotra 1 sArtha

File name : navanew.itx

Category : nava, navagraha, stotra, vyAsa

Location : doc_z_misc_navagraha

Author : vyAsa

Transliterated by : NA

Translated by : Vidhyanath Rao and Srinivas Kalyanaraman

Latest update : December 1, 2013

Send corrections to : sanskrit@cheerful.com

This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

Please help to maintain respect for volunteer spirit.

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

June 9, 2023

sanskritdocuments.org



Navagrahastotra (with meanings)

नवग्रहस्तोत्र



जपाकुसुमसंकाशं काश्यपेयं मंडाद्युतिम् ।
तमोऽरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् ॥ १ ॥

I pray to the Sun, the day-maker, destroyer of
all sins, the enemy of darkness, of great
brilliance, the descendent of KAshyapa, the
one who shines like the japA flower .
दधिशङ्खतुषारात्मं क्षीरोदार्णवसंभवम् ।
नमामि शशिनं सोमं शम्भोर्मुकुटभूषणम् ॥ २ ॥

I pray to the Moon who shines coolly like curds
or a white shell, who arose from the ocean
of milk, who has a hare on him, Soma, who
is the ornament of Shiva's hair .
धरणीगर्भसंभूतं विद्युत्कान्तिसमप्रभम् ।
कुमारं शक्तिवस्तं तं मङ्गलं प्रणामाम्यहम् ॥ ३ ॥

I pray to Mars, born of Earth, who shines
with the same brilliance as lightning, the
young man who carries a spear .
प्रियङ्गुकविकाश्यामं रुपेणाप्रतिमं बुधम् ।
सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणामाम्यहम् ॥ ४ ॥

I pray to Mercury, dark like the bud of millet,
of unequalled beauty, gentle and agreeable .
देवानां य ऋषीणां य गुरुं काञ्चनसंनिभम् ।
बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् ॥ ५ ॥

I pray to Jupiter, the teacher of gods and

rishis, intellect incarnate, lord of the
three worlds .

छिमकुन्दमुणालाभं दैत्यानां परमं गुरुम् ।
सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् ॥ ६ ॥

I pray to Venus, the ultimate preceptor of
demons, promulgator of all learning, he who
shines like the fiber of snow-white jasmine .

नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाञ्जम् ।
छायामार्तार्णसंभूतं तं नमामि शनैश्चरम् ॥ ७ ॥

I pray to Saturn, the slow moving, born of
Shade and Sun, the elder brother of Yama,
the offspring of Sun, he who has the
appearance of black collyrium .

अर्धकायं मडावीर्यं चन्द्रादित्यविमर्दनम् ।
सिद्धिकागर्भसंभूतं तं राहुं प्रणमाम्यहम् ॥ ८ ॥

I pray to Rahu, having half a body, of great
bravery, the eclipser of the Moon and the Sun,
born of SimhikA .

पलाशपुष्परंकाशं तारकाग्रहमस्तकम् ।
रौद्रं रौद्रात्मकं धीरं तं केतुं प्रणमाम्यहम् ॥ ९ ॥

I pray to Ketu, who has the appearance of
PalAsha flower, the head of stars and planets,
fierce and terrifying .

छति व्यासमुणोद्गीतं यः पठेत्सुसमाहितः ।
दिव्यं वा चदिव्यं वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति ॥ १० ॥

Those who read the song sung by VyAsa,
will be joyous, sovereign and powerful,
and will succeed in appeasing obstacles,
occurring by day or by night .

नरनारीनृपाणां च भवेद्दुस्वप्ननाशनम् ।

ऐश्वर्यमतुलं तेषामारोग्यं पुष्टिवर्धनम् ॥

Bad dreams of men, women and kings alike
will be destroyed and they will be endowed
with unparalleled riches, good health and
enhancing nourishment .

ग्रहनक्षत्रजः पीडास्तस्कराग्निसमुद्भवाः ।

ताः सर्वाः प्रशमं यान्ति व्यासो भूते न संशयः ॥

All the pain, devastation caused by
fire, planets and stars will be of
the past, so spoke VyAsa, emphatically .

॥ इति श्रीव्यासविरचितं नवग्रहस्तोत्रं सम्पूर्णम् ॥

Thus ends the song of praise of the
nine planets composed by VyAsa .

Navagrahastotra (with meanings)

नवग्रहस्तोत्र

स्तोत्रम्



जपाङ्गुसुमसंकाशं काश्यपेयं मडाद्युतिम् ।
तमोऽरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरम् ॥ १ ॥
दधिशङ्खतुषारालं क्षीरोदार्वसंभवम् ।
नमामि शशिनं सोमं शम्भोर्मुकुटभूषणम् ॥ २ ॥
धरणीगर्भसंभूतं विद्युत्कान्तिसमप्रभम् ।
कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणामाम्यहम् ॥ ३ ॥
प्रियङ्गुकविकाश्यामं रुपेणाप्रतिमं बुधम् ।
सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणामाम्यहम् ॥ ४ ॥
देवानां य ऋषीणां य गुरुं काञ्चनसंनिभम् ।
बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् ॥ ५ ॥
छिम्बुन्दमुणालालं दैत्यानां परमं गुरुम् ।
सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणामाम्यहम् ॥ ६ ॥
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम् ।
छायामार्तार्णसंभूतं तं नमामि शनैश्चरम् ॥ ७ ॥
अर्धकायं मडावीर्यं यन्द्रादित्यविमर्दनम् ।
सिंहिकागर्भसंभूतं तं राहुं प्रणामाम्यहम् ॥ ८ ॥
पलाशपुष्पसंकाशं तारकाग्रहमस्तकम् ।
रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणामाम्यहम् ॥ ९ ॥
धृति व्यासमुणोद्गीतं यः पठेत्सुसमाहितः ।
दिव्यं वा यद्वि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति ॥ १० ॥
नरनारीनृपाणां य भवेद्दुःस्वप्ननाशनम् ।

अैश्वर्यमतुलं तेषामारोग्यं पुष्टिवर्धनम् ॥

ग्रहनक्षत्रजाः पीडास्तस्कराग्निसमुद्भवाः ।


ताः सर्वाः प्रशमं यान्ति व्यासो भूते न संशयः ॥

॥ इति श्रीव्यासविरचितं नवग्रहस्तोत्रं सम्पूर्णम् ॥


Encoded by NA

Proofread by NA, Kirk Wortman

Translations Dr . Vidhyanath Rao and Dr . Srinivas Kalyanaraman .

——
Navagrahastotra (with meanings)

pdf was typeset on June 9, 2023

——
Please send corrections to sanskrit@cheerful.com

